

The Principle of Karmayoga...

...To be able to do anything with equanimity is the principle of Karmayoga and to do with joy because it is done for the Mother is the true psychic and vital condition in this yoga.

(SABCL-23 P. 680)

– Sri Aurobindo

કર્મયોગનો મૂળ સિદ્ધાંત...

...કોઈપણ કર્મ સમતાપૂર્વક કરવું એ કર્મયોગનો મૂળ સિદ્ધાંત છે, વળી કર્મ આનંદપૂર્વક કરવું કારણકે તે શ્રીમાતાજી માટે કરવાનું છે. આ યોગમાં આ જ સાચું ચૈતસિક વલણ અને પ્રાણનો સાચો અભિગમ હોય છે.

‘યોગ પર પત્રો’ માંથી

– શ્રી અરવિન્દ

(SABCL-23 P. 680)



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિક્તિ

2025

SEPTEMBER

૧ સપ્ટેમ્બર, ૨૦૨૫

Perfection in the work ...

કાર્યમાં પૂર્ણતા ...

*Perfection in the work
must be the aim,
but it is only by a
very patient effort that
this can be obtained*

my blessings

Perfection in the work must be the aim, but it is only by a very patient effort that this can be obtained.

With my blessings

– The Mother

કામમાં સંપૂર્ણતા એ જ ધ્યેય હોવું જોઈએ, પણ આ સંપૂર્ણતા ખૂબ ખંતભરેલ પ્રયત્નથી જ મેળવી શકાય છે.

મારા આશીર્વાદ સાથે

– શ્રી માતાજી

©SRI AUROBINDO ASHRAM TRUST, PONDICHERRY.
FROM: SRI AUROBINDO KENDRA,
MATRUBHAVAN 87, SWASTIK SOCIETY, AHMEDABAD-9
<https://themothersprosperity.org>

Mantras of the Mother - 12 April 1954 / શ્રી માતાજીના મંત્રો - ૧૨ એપ્રિલ
૧૯૫૪

Work for the Divine

Your object is not only to practice yoga for your internal progress and protection but also to do a work for the Divine.

*

The only work that spiritually purifies is that which is done without personal motives, without desire for fame or public recognition or worldly greatness, without insistence on one's own mental motives or vital lusts and demands or physical preferences, without vanity or crude self-assertion or claims for position or prestige, done for the sake of the Divine alone and at the command of the Divine. All work done in an egoistic spirit, however good for people in the world of the Ignorance, is of no avail to the seekers of the yoga.

... what is important is the spirit of offering put into the work. If one can in addition remember the Mother in the work or through a certain concentration feel the Mother's presence or force sustaining or doing the work, that carries the spiritual effectivity still farther. But even if one cannot in moments of clouding, depression or struggle do these things, yet there can be behind a love or bhakti which was the original motive power of the work and that can remain behind the cloud and re-emerge like the sun after dark periods.

(SABCL-23 P. 677)

– Sri Aurobindo

પ્રભુ પ્રીત્યર્થે કર્મ

તમારું લક્ષ્ય માત્ર તમારી આંતરિક પ્રગતિ અને રક્ષણ માટે યોગસાધના કરવાનું નથી પરંતુ પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવાનું પણ છે.

*

સાધકને માત્ર એ જ કર્મો આધ્યાત્મિક રીતે વિશુદ્ધ કરે છે જે કર્મો કોઈ અંગત હેતુ વગર, કીર્તિની કામના કે લોકપ્રિય થવાની કે લૌકિક મહત્તાની ઇચ્છા વગર પોતાના મનના હેતુઓને પાર પાડવાના આગ્રહ વગર કે પ્રાણની મોહમયી લાલસા કે માગણી અને ભૌતિક ગમા-અણગમા વગર, ગર્વિષ્ઠ ભાવ વગર, કે પદ-પ્રતિષ્ઠાના ગ્રામ્ય, અહંપ્રધાન હક-દાવા વગર માત્ર પ્રભુને ખાતર અને પ્રભુના આદેશ પ્રમાણે કરવામાં આવે છે. બાકીનાં બધાં કર્મો જે અહંતાયુક્ત ભાવના સાથે કરવામાં આવે છે, તે ભલે અજ્ઞાનમય જગતનાં લોકોની ભલાઈ માટે કરવામાં આવ્યાં હોય તો પણ તે કર્મો યોગમાર્ગના મુમુક્ષુ માટે કોઈ રીતે ઉપયોગી નથી. ... અર્પણના ભાવ સહિત કર્મ કરવું એ જ મહત્વનું છે, ઉપરાંત કર્મ કરતી વખતે સાધક જો શ્રીમાતાજી નું સ્મરણ કરી શકે કે કોઈ રીતે એકાગ્રતા દ્વારા શ્રીમાતાજીની સંનિધિ કે શક્તિ, કે જે સાધકને કર્મમાં ટકાવી રાખનારી કે સ્વયં કર્મ કરનાર શક્તિ છે તેનો અનુભવ કરી શકે તો તે આધ્યાત્મિક અસરને વધુને વધુ આગળ લઈ જાય છે; પરંતુ કદાચ, જો સાધક સાધનાની મંદ ગતિમાં, અવસાદ કે આંતરિક સંઘર્ષની સ્થિતિમાં શ્રીમાતાજીનું સ્મરણ કે એકાગ્રતા ન કરી શકે તો પણ સાધકના પ્રયત્નની પાછળ પ્રભુને માટે પ્રેમ અને ભક્તિ હોઈ શકે છે, જે સાધકના કર્મની મૂળ પ્રેરક શક્તિ હતી, તે વાદળાં પાછળ આચ્છાદિત સ્થિતિમાં હોઈ શકે છે. અને જેવાં વાદળાં દૂર થાય કે તુર્તજ તેજસ્વી સૂર્યની જેમ તે પુનઃપ્રકાશી ઊઠે છે.

‘યોગ ઉપર પત્રો’ માંથી

(SABCL-23 P. 677)

– શ્રી અરવિન્દ